

દાણી થેગજનક વનસ પતે જે જુલાબને કાથાબુત છે અને બધ થેગજનક જેને મુખ્ય કાથાબે લીધે જુલાબ થય છે. તેમુ મુખ્ય અથ્થા અનોખુ કાથા તેમેટેથી પશ્ચાથા થય છે. મેટેથી પશ્ચાથા પાણીને મુબુત છે. ખોથકને લીધે અથ્થા સીધુ પશ્ચાથા થુ જે સુચતિકે છે જે મેટેથી બેજા થસ ત જેવા કે આંગળી વડે અથ્થા રેપ લગાવત જેતુ અથ્થા મેલ જે નાના બળકો ખાય છે.

ગુજરાતી ભાષા સંસ્થા

ગથીબધમં બળકને જુલાબ થેકવા મટે ધમથવણ છોડાવવુ ક ગંભીર જોખમ છે. બળકને જીવનના છ મ્હીના પહેલા ધમથવવાનુ છોડાવવુ જોઈ. તેમી બ્દલીમં ત્તી વવાળો પૌષ ટીક ખોથક આપવો.

ગુજરાતી ભાષા સંસ્થા ?

જુલાબ મ્હાથક ટથં ક સાથ વજનકિ આથેગચની સમ્સયા છે. ખાસ કથીને બળકે જે પ વથ ધની ઉમ્મ કથત છે. ક સંપુથ ણ વક્રિતમ્નોદશા પહેલા ઠે વથ ધોમં ૧/૩થી વધે છે. નો અથ થ કે જુલાબના થેગને થેકવા મટે સમ્સયથેગચ પગલા લેવા જોઈ.

ગુજરાતી ભાષા સંસ્થા

- પથંપથગતથીતપાણીનો સુધ્યે પુથ્વકો
- સુધ્યે મ્હામ્તી થ્નો કથ્થનો નકિલ અને સુધ્યુતઘથ્થુથી અને ખોથકની સવર છત
- ખોથક બનાવત પહેલા
- જમ્ત પહેલા
- બળકને ધમથવત પહેલા સંડાસ કથવવુ
- સંડાસ કથયા પછી બળકને સાફ કથીને, બળકના સંડાસનો નકિલ કથયા પછી
- બધ કુટુંબે સવર છત થખી સંડાસને વાપથ્થુ

ગુજરાતી ભાષા સંસ્થા

આથેગચના શકિ ધણી પથ્થુતી તે સમજના સભચોને ખાત્થી કથવીને અને તેને મ્દ કથીને કેટલીક થેકી શકે તેમી ટેવો જેવી કે બળકને સાથી થીતે ધમથવવુ, પીવાનુ સાફ પાણી આપવુ અને પુથ ણપણે સવર છત થખીને પાણીનો વપથશ કથ્થો, સાફ સંડાસ વાપથ્થો અને મ્હામ્તી થ્નો નકિલ કથ્થા મટે અભચાસ કથે છે.

ગુજરાતી ભાષા સંસ્થા જુલાબને થેકવા મટે થીની દખલગીથી થેગના રેપને મુક તથ્થા મટે કથે છે. જયાથે સુરના આપેલ પથ્થાણી ઉમ્મે આપવામં આવે છે, તેયાથે થી મટે થ્સી ૨૫% જેટલા પ વથ ધથી નાના બળકોના જુલાબને લીધે થ્મ મ્તીચુ બ્યવે છે.

ગુજરાતી ભાષા સંસ્થા

જુલાબના થેગને નચિંતી થ્થા (DDC) મં લાવવાનો કાથચક ૨૧૯૭૮મં ચલુ કથ્થો હતે. તેથે જુલાબના થેગને નચિંતી થ્થામં લાવવા અને અટકાવવા, ઉપચક મતી થમં શૂપથેખા દોથી હતે. જો બ્યેબ શકિ ધણ જુલાબના થેગને લગતુ આપવામં આવે તે તેવક્રિતમ્નોદશા અને મ્તીચુના દથ્ને છે કથ્થે.

૧૯૮૫-૮૮થી The National Oral Re-hydration Therapy Programmeના પથ્થથંબ્થી પી પથ્થુતી તેને કેંદ થતિ કથી છે, જે પ વથ ધથી નાના બળકોને થ્થ જુલાબ થેકવા ઉપથ સંચલનને મ્હુબુતબનાવીને અને દેશમં મ્હાતે દવાનુ જાન વધથીને અને ORSનો ઉપથેગ કથી અને ચલુ થ્હેલા ધમથવણ વગેથે.